

TML: CS: BSE-NSE/CORR /2021-22

25th August, 2021

Listing Department, **BSE Limited**,

P. J. Towers, Dalal Street,

Mumbai-400001

Listing Department,

National Stock Exchange of India Ltd.

"Exchange Plaza",

Bandra – Kurla Complex,

Bandra – East, Mumbai- 400 051

Dear Sir/Madam,

Sub: Newspaper Advertisement pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

Ref: 1. Regulation 47 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015

2. BSE Scrip Code: 530199

3. NSE Scrip Code: THEMISMED

In terms of Regulation 47 of the SEBI (LODR) Regulations, 2015 and in compliance with Ministry of Corporate Affairs Circular No. 20/2020 dated 5th May, 2020 and Circular No. 02/2021 dated 13th January, 2021the Company has published the public notice of the 51st Annual General Meeting, Book Closure for Dividend and other related information in the "Indian Express" (English) Newspaper edition & in 'Financial Express' (Gujarati) edition dated 24th August, 2021.

Further, in pursuance of Regulation 30 read with Schedule III (A) (12) please find enclosed the copy of Newspaper articles as published in above mentioned newspapers.

Kindly take the same on record and acknowledge receipt.

Thanking you,

Yours Faithfully

For Themis Medicare Limited

Sangameshwar lyer

Company Secretary& Compliance Officer

Encl: a/a

Themis Medicare Limited

Corporate Office: 11/12, Udyog Nagar, S. V. Road, Goregaon (West), Mumbai - 400 104. India Tel.: 91-22-6760 7080 • Fax: 91-22-6760 7070 / 2874 6621

Regd. Office: Plot No. 69-A, G.I.D.C. Industrial Estate, Vapi - 396 195, Gujarat. **CIN No.: L24110GJ1969PLC001590 • Tel / Fax No.: Regd. Off.**: 0260 2431447 / 2430219

• E-mail : themis@themismedicare.com • Website : www.themismedicare.com

GUJARAT

SURENDRANAGAR

6 income tax officers, 5 cops injured as mini bus rams tree

EXPRESS NEWS SERVICE RAJKOT, AUGUST 24

SIX OFFICERS of the Income Tax Department (I-T) and five women constables of Ahmedabad city police were injured after a mini bus in which they were travelling

from Ahmedabad skidded off the

Somasar village in Surendranagar

district early on Tuesday. Police said the incident took place at around 4.30 am near Somasar village of Surendranagar's Muli taluka on State Highway 17, which connects Surendranagar town with Rajkot, on Tuesday when the team was heading to

Rajkot for conducting raids. "A team of I-T and police were travelling in a private bus that rolled off the road. Eleven persons have been injured. Two men and two women sustained fractures and have been hospitalised. However, there are no casualties.' Superintendent of Police (SP) of Surendranagar, Mahendra Bagaria, told The Indian Express.

EXPRESS NEWS SERVICE

AS MANY as 15 daily wage work-

ers were injured in Subir Taluka

of Dang on Tuesday when a

truck carrying them met with an

According to police, the acci-

accident and turned sideways.

dent occurred on Tuesday

morning on the state highway

road adjacent to Daher village,

when the driver of the truck lost

control over the truck leading

the vehicle to be collapsed. All

15 workers travelling in the

truck fell and came under the

impact of the truck, informed

workers including 10 men and

5 women were hired under the

Mahatma Gandhi National Rural

Employment Guarantee Act

(MNREGA) for construction

work in Daher village panchayat

and the workers were headed

towards construction site when

of the steering wheel due to

which the vehicle swirled side-

ways and collapsed on the side

of the highway. All 15 workers

were taken to Subir Primary

Health Care centre in which 10

were given first aid and dis-

charged. Five of them are still

being treated. We have not

lodged any case in the matter,"

said a police official at Subir

Police Station.

"The truck driver lost control

the accident occurred.

According to police, the 15

the police.

AHMEDABAD, AUGUST 14



The minibus bus that met with the accident. Express

The injured were identified as Rajkumar Gupta, Amit Gupta, Ojas Parikh, Rohit Thakkar, Uma Shankar Prasad and Prakash Thakkar — all income tax inspectors. The injured constables are Shraddha Dodiya, Nagabhai, Komal Dhanjibhai Kajalben Valabhai and Asmita Karshanbhai. The women constables were part of the armed Lok Raskhak Dal personnel posted at the headquarters of Ahmedabad

Eyewitnesses told The Indian Express that two officers of the IT department and one woman constable sustained fractures while others sustained minor injuries.

"The injured were rushed to a hospital in Surendranagar town from where they were referred to Shalby Hospital in Ahmedabad," said SS Varu, police sub-inspector of Muli. "Based on information provided by Rajendra Thakkar, income tax inspector of Surendranagar, we have registered a non-cognisable offence as of now," he said adding bus driver Dashrath also sustained minor in-

The public relations officer (PRO) for the Gujarat region of Income Tax department confirmed the accident and injuries to officers but refused to divulge further information.

Meanwhile, other teams of the I-T department launched simultaneous raids on the premises of RK Group, a leading realty group of Rajkot, and its business associates, Tuesday morning.

Allow mandatory physical exams from class 6: Pvt school body to govt

EXPRESS NEWS SERVICE AHMEDABAD, AUGUST 24

ASSOCIATION Promotion of Prominent Schools has urged to the state government to allow reopening of schools and conducting compulsory exams fprm Class 6 onwards to be taken physically.

Stating that online education over the last one -and-a-half year have affected children due to lack of access or diversions at home resulting in many children falling behind others leading to learning gaps among students, the association has suggested 'to allow compulsory exams to be taken physically in schools from Class 6 onwards for the half yearly test which is due for CBSE schools in September.

"This will help parents, students and schools to identify the students and topics which require remedial steps to be taken. We can compare with past year's

green**pe**ll

The association said online education over the last one –and-ahalf year has affected children due to lack of access or diversions at home resulting in

results of the school and students to measure the magnitude of the problem,' the letter written to Education Minister Bhupendrasinh Chudasama Tuesday states.

many children falling

behind others

Since schools and parents used to take corrective action in the past when a child used to fall behind academically but with online schooling even children themselves are not aware whether they have acquired the

NOTICE OF 26[™] ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION

held on Friday, 24th September, 2021 at 11.30 AM IST through Video Conferencing ("VC") or Other Audio Visual

Means ("OAVM") to transact the business as set out in the Notice of the 26th AGM in compliance with the

applicable provisions of the Companies Act, 2013 ('Act') & Rules framed thereunder and the SEBI (Listing

Obligations and Disclosure Requirements) Regulations, 2015 ('Listing Regulations') read with General Circular

Nos. 14/2020, 17/2020 and 20/2020 dated April 08, 2020, April 13, 2020 and May 05, 2020 and Circular No.

02/2021 dated January 13, 2021 respectively, issued by the Ministry of Corporate Affairs ('MCA Circulars') and

Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 and Circular dated January 15, 2021

issued by the Securities and Exchange Board of India ('SEBI Circular') to transact the business as mentioned ir

Pursuant to Section 101 of the Act and Regulation 36 of the Listing Regulations and in compliance with the

MCA Circulars and SEBI Circular, the Notice of 26th AGM along with the Annual Report 2020-21 will be send to all

the Shareholders whose email addresses are registered with the Company / Registrar and Share Transfer Agent /

Depositories. The requirements of sending physical copy of the Notice of the 26th AGM and Annual Report to the

Members have been dispensed with vide MCA Circulars and SEBI Circular. Members are hereby informed that the

said Annual Report including AGM Notice is also available on the Company's website www.ahimsaind.com

website of the Stock Exchange i.e. NSE Limited at www.nseindia.com and on the website of National Securities

Pursuant to Section 108 of the Act and Regulation 44 of the Listing Regulations, the Company is providing its

members the e-voting facility to cast their votes on all the resolutions set out in the AGM Notice by using an

electronic voting system from a place other than the venue of the AGM (i.e. remote e-voting). The Company will

also provide a facility of e-voting to members during the AGM, who have not cast their vote by remote e-voting. The

Company has entered into an arrangement with NSDL for providing the remote e-voting and e-voting during the

AGM. A person whose name appears on the Register of Members / Beneficial Owners as on the cut-off date i.e.

Friday, 17th September, 2021 shall only be entitled to avail the remote e-voting facility or e-voting during the AGM.

Thursday, 23rd September, 2021 (5.00 p.m. IST). During this period, the member(s) of the Company may cast their

votes electronically on items mentioned in the AGM Notice. Once the vote on a resolution is cast by a member, any

subsequent change shall not be allowed. The voting rights of the members shall be in proportion to their shares in

paid-up share capital of the Company as on the cut-off date i.e. Friday, 17th September, 2021. The detailed

instructions relating to remote e-voting and e-voting during the AGM are provided in the Notes forming part of the

Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through

e-voting system available during the 26th AGM. Members who have cast their vote through remote e-voting will be

eligible to attend the AGM. However, they will not be eligible to vote at the AGM. The details procedure for voting at

e-AGM mentioned in the Notes to Notice of the meeting. Share Transfer books shall remain closed from Friday,

September 17, 2021 to Friday, September 24, 2021, both days inclusive.

Only those Members, who will be present in the AGM through VC / OAVM and have not cast their vote on the

The remote e-voting period will commence on Tuesday, 21st September, 2021 (09.00 AM IST) and will end on

the 26th AGM Notice, without the physical presence of the Members at a common venue.

Depositories Limited (NSDL) at www.evoting.nsdl.com.

Notice is hereby given that the 26th Annual General Meeting (AGM) of the Shareholders of the Company will be

Ahimsa Industries Limited

CIN: L25200GJ1996PLC028679

Reg. Office: 160, Devraj Industrial Park, Piplaj-Pirana Road,

Village Piplaj Ahmedabad GJ 382045

Email: ahimsagreenpet@ymail.com • Website: www.ahimsaind.com

minimum basic knowledge to get promoted to next class, said president of AOPS, Manan

The association with 40 schools had earlier appealed to the state government to allow physical reopening of schools. At present, schools are opened for classes 9-12.

Further, suggesting standard operating procedures for exams, the association has stated in its representation that since students do not need to come to school for more than 2-3 hours at a stretch, lunch break will not t be needed, thus avoiding the "mask-less" time.

Also, the exams can be planned in three batches with not more than 33 per cent capacity of school, the letter said. In case schools are not opened normally for a few more months then only those students who have not secured passing marks can be called to school for remedial classes, it added.

For Ahimsa Industries Limited

INDIAN

EXPRESS

Sd/- Ashutosh Gandhi

Managing Director

THEMIS MEDICARE LIMITED

CIN: L24110GJ1969PLC001590

Regd. Office. Plot no. 69-A, GIDC Industrial Estate, Vapi-396 195, Dist. Valsad, Gujarat Phone No: 91-22-67607080 Fax: 91-22-67607019 Website http://www.themismedicare.com. | E-mail: themis@themismedicare.com

NOTICE

1. NOTICE is hereby given that the 51st Annual General Meeting (AGM) of Themis Medicare Limited (the Company) will be held hrough Video Conferencing("VC")/Other Audio-Visual Means("OAVM") on Friday, 18th September, 2021 at 12 Noon, ir compliance with all the applicable provisions of the Companies Act, 2013 and rules made thereunder and the Securities and Exchange Board of India(Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, read with General Circulars No. 14/2020 dated April 08, 2020; No. 17/2020 dated April 13, 2020 and No.20/2020 dated May 5, 2020, No. 02/2021 dated January 13, 2021 and other applicable circulars issued by the Ministry of Corporate Affairs("MCA") and circular No. SEBI/HO/CFD/ CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 and Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021 of SEBI (collectively referred to as "applicable circulars"), to transact the business set out in the Notice convening the AGM. Members will be able to attend and vote at the AGM through VC/OAVM Members participating through the VC/OAVM facility only shall be deemed to be present at the AGM and their presence shall be reckoned for the purpose of augrum

2. In compliance with the applicable circulars, the Notice convening the AGM and the standalone and consolidated financial statements for the financial year 2020-21, along with Board's Report, Auditors' Report and other documents required to be attached thereto, will be sent to all the Members of the Company whose email addresses are registered with Company/ Depository Participants(s). Considering the COVID-19 pandemic, the Company shall not be able to provide service of documents to the shareholders, except through email. Hence, the Company requests all the shareholders who have not yet registered their email addresses or have not updated their email addresses with the Company/RTA to register the same. The aforesaid documents will also be available on the Company's website at www.themismedicare.com and on the website of the Stock Exchanges i.e. BSE Limited and NSE Limited at www.bseindia.com and www.nseindia.com respectively,and also on the website of Central Depository Services (India) Limited CDSL) at www.evotingindia.com.

3. Manner of registering/updating email address by members: a. In case of Shares held in Physical Mode

. In the case of Shares held in Demat mode

The Shareholder may send a request quoting its Folio No. to RTA ov email at rnt.helpdesk@linkintime.co.in

The shareholder may please contact the Depository Participant "DP") and register the email address and bank account details ir

4. Manner of casting vote(s)

a) Members will have an opportunity to cast their vote(s) on the ousiness as set out in the Notice of the AGM through electronic

b) The Manner of voting remotely ("remote e-voting") by members nolding shares in dematerialized mode, physical mode and for nembers who have not registered their email address has beer provided in the Notice of AGM.

r) The facility for voting through electronic voting system will also be made available at the AGM and Members attending the AGM through VC/OAVM who have not cast their vote(s) by remote e

oting will be able to vote at the AGM. d) The login credentials for casting votes through e-voting shall be nade available to the members through email. Members who do not receive email or whose email address are not registered with Company/RTA/Depository Participant(s), may generate login credentials by following instructions given in the 'Notes' forming art of Notice of AGM.

) The login credentials and manner for attending the AGM hrough VC/OAVM can be obtained by following instructions given in the 'Notes' forming part of Notice of AGM

a) The Board has recommended a dividend of Rs. 4.30/- per share at its meeting held on 27th May, 2021. The Register of Members and Share Transfer Books will remained closed from Saturday, 11th September 2021 to Saturday,18th September 2021 (both days inclusive) for the purpose of AGM and determining the names of the Members eligible for payment of dividend for the financial year 2020-21, if declared at the AGM.

b) Subject to approval of members at the AGM, the dividend will be paid to the Members whose name appear on the Company's Register of Members as on Saturday 10th September, 2021, and n respect of shares held in demat mode, to the Members whose names are furnished by National Securities Depository Limited "NSDL") and the Central Depository Services (India) Limited 'CDSL"), collectively "Depositories" as beneficial owners as on hat date.

c) As per the applicable circulars payment of dividend shall be made through electronic mode to the members who have updated their bank account details. Dividend warrants / demand drafts will be dispatched to the registered address of the shareholders who have not updated their bank account details, after normalization of the postal services.

d) Payment of dividend will be subject to deduction of Tax at source (TDS) at applicable rate. For more details please refer to the 'Notes' forming part of Notice of AGM.

6. Manner of registering mandate for receiving Dividend.

Members are requested to register/update their complete bank

a) With their depository participant(s) with whom they maintain their demat accounts, if shares are held in dematerialized mode by submitting the requisite documents and

b) With the Company/Link Intime Private Limited by emailing at cfoassist@themismedicare.com or

rnt.helpdesk@linkintime.co.in, if shares are held in physical mode, by submitting (i) scanned copy of the signed request letter which shall contain member's name, folio number, bank details(Bank account number, Bank Branch name and address IFSC, MICR details), (ii) self attested copy of the Pan card and (iii) cancelled cheque leaf

7. Members are requested to read and understand all the 'Notes' forming part of the Notice convening AGM Particularly those dealing with manner of casting vote through remote e-voting or during AGM.

By order of Board For Themis Medicare Limited

Ahmedabad

Place: Mumbai

Sangameshwar lyer (Company Secretary& Compliance officer)

reers



Advertisement No. IITRPR/FACRECT/03/2021 Advertisement No. IITRPR/FACRECT/03/2021

Special Recruitment drive for faculty positions in SC/ST/OBC/EWS categories Indian Institute of Technology Ropar invites applications from qualified candidates for the post of Assistant Professor Grade-I from the candidates belonging to SC/ST/OBC/ EWS categories in the specific areas of specializations in the Departments of Biomedical Engineering, Chemistry, Chemical Engineering, Civil Engineering, Computer Science & Engineering, Electrical Engineering, Humanities & Social Sciences, Mathematics, Mechanical Engineering, Metallurgical and Materials Engineering and Physics.

For details regarding educational qualification, experience, areas of specialization, and other details, please visit the institute website http://www.iitrpr.ac.in/jobs/faculty-positions.

The last date for submission of online applications is 24.09.2021 কুলেমবিব/REGISTRAR

Dangs: Fifteen **ONGC VIDESH LIMITED** workers injured in truck accident

ADVERTISEMENT FOR ENGAGEMENT OF CONSULTANTS

Applications are invited from eligible superannuated employees of CPSEs under the administrative control of Ministry of Petroleum and Natural Gas, Govt of India for engagement of Consultant/Advisors in ONGC Videsh Ltd. purely on contractual basis. For details of the requirement please visit website: www.ongcvidesh.com. Last date for receipt of application is 15 days from date of publication of this advertisement.



Head Office: Star House, C-5, G-Block, Bandra - Kurla Complex, Bandra East, Mumbai - 51.

Bank of India invites RFP from eligible Life Insurance Companies with a view of entering into Corporate Agency arrangement for distribution of Life

Insurance products in India For details please visit our website at www.bankofindia.co.in. Last date of submission of bid is September 14, 2021.

CENTRAL WAREHOUSING CORPORATION

Place: Ahmedabad Date : August 24th, 2021

at e-mail: evoting@nsdl.co.in, Tel. No.: 022-24994738.

26th AGM Notice.

In case of any queries or issues regarding attending AGM/e-voting, members may refer to the Frequently Asked Questions (FAQs) and e-voting manual available at www.evoting.nsdl.com or contact Ms Sarita Mote, NSDL, 4th Floor, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai - 400013

(A Govt. of India Undertaking) 4/1, Siri Institutional Area, August Kranti Marg, Hauz Khas, New Delhi-110016 Ph: 26566107, Ext 336/257 Warehousing for Everyone NOTICE

59th Annual General Meeting of the Central Warehousing Corporation will be held through Video Conferencing (VC) at 12.00 hrs on 28.09.2021. Detailed notice in this regard is sent to all shareholders to their registered address by speed post with detailed instruction for participation. Participants have to send duly filled Proxy form (Original-1)/ Resolution through post/courier so as to reach us on or before 17.00 hrs on 24 th September, 2021. Shareholders are also advised to send a scanned Proxy form (Original-1) having hologram/Resolution to our email secycwc@cewacor.nic.in or on WhatsApp no. +91-99712-36904. As such Proxy-1 & Resolution issued prior to the date of notice i.e. 25.08.2021 and deposited after 24.09.2021 will not be entertained i.e. 25.08.2021 and deposited and 24.09.2021 willing.

For detailed information please log on to www.cewacor.nic.in

Secretary, CWC



Presents





Call for Entries 2020

Acknowledging accuracy, courage, credibility & fairness

October 15, 2021 Last date for entries

Print/Digital & Broadcast

Hindi
 Regional Languages
 Uncovering India Invisible
 Business and Economic Journalism

• Environment, Science and Technology Reporting • Reporting on Politics and Government • Sports Journalism • Investigative Reporting

 Reporting on Arts, Culture and Entertainment
 Books (Non-Fiction)
 Foreign Correspondent Covering India Prakash Kardaley Memorial Award for Civic Journalism
 Photo Journalism

Entries are invited for the year 2020 only | To apply, log on to www.rngfoundation.com/awards

છેક્ષા ૭૦ વરસમાં બનાવાયેલી સંપત્તિ વેચવામાં આવી રહી છે: રાહુલ ગાંધી

પીટીઆઈ નવી દિલ્હી, તા.૨૪

ક્ષેત્રોમાં પોતાની સંપિત્તનું કે પગલા પર સવાલ ઉઠાવતા મખ્ય જણાવ્યું હતું કે, છેજ્ઞા ૭૦ બનાવવાનો

પી ચિદમ્પબરમ સાથે અહિં મુદ્રીકરણ પત્રકાર પરિષદને સંબોધતા (એનએમપી) અનાવરણ કર્યું તેમણે જણાવ્યું હતું કે, ભાજપે હતું જેમાં પેસેનેજર ટ્રેન અને દાવો કર્યો છે કે ભારતમાં ૭૦ રેલવે સ્ટેશનની લઈને વર્ષ સુધી કશું થયું નથી પરંતુ એરપોર્ટ, રસ્તા અને સ્ટેડિયમ

ગાંધીએ મંગળવારે મુખ્ય ગાંધીએ આરોપ લગાવ્યો હતો સમાવેશ થાય છે. મોદી સરકારની ક્ષેત્રોમાં ઈજારો સંપત્તિ વેચવામાં આવી રહી નાણામંત્રી નિર્મલા સીતારણે સોમવારે મહત્વકાંક્ષી રૂપિયા ભૂતપૂર્વ કેન્દ્રીય નાણામંત્રી ૬ લાખ કરોડની રાષ્ટ્રીય પાઈપલાઈનનું

હવે આ તમામ વર્ષોમાં સુધીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં સર્જોયલી તમામ સંપત્તિ ખાનગી કંપનીઓને સામેલ કોંગ્રેસના નેતા રાહુલ વેચવામાં આવી રહી છે. કરીને ઓનલોકિંગના મૂલ્યનો

૨૫ જેટલા એરપોટર્સ મુદ્રીકરણ કરવાના સરકારના ખાનગીકરણ યોજનાનો ઉદ્દેશ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ) એરપોર્ટ, જેમાં ચેન્નાઈ, ભોપાલ, વારાણસી, વર્ષમાં બનાવેલી તમામ નોકરીઓને ખતમ કરશે. અને વડોદરા તેમજ ૪૦ રેલવે સ્ટેશન, ૧૫ રેલવે સ્ટેડિયમ અને અજાણી સંખ્યામાં રેલવે કોલોનીઓ ખાનગી રોકાણ મેળવવા માટે ઓળખવામાં આવે છે.

Bokaro Power Supply Co. (P) Ltd.

(A Joint Venture of SAIL & DVC) Old Administrative Building, ISPAT Bhawan, Bokaro Steel City, Jharkhand CIN No.: U40300DL2001PTC112074

Availability of Fly Ash / Pond Ash in BPSCL is displayed in the company's website www.bpscl.com. Firms interested in lifting Fly Ash / Pond Ash may refer to the same.

(I) IDBI BANK

IDBI BANK LIMITED Regd. Office: IDBI Tower, WTC Complex, Cuffe Parade, Mumbai - 400005.

CIN: L65190MH2004G0I148838 **TENDER NOTICE**

REQUEST FOR PROPOSAL (RFP) FOR SELECTION AS OSV FOR PROVIDING MARKETING AND BACK OFFICE SUPPORT SERVICES

IDBI Bank Ltd. wishes to invite bids from eligible Outsourcing Vendors (OSV) for providing Marketing & Back Office Support Services for its Branches / Offices / Establishments. Interested Vendors may download the RFP document from IDBI Bank's website www.idbibank.in (Notices & Tenders). All bids must be submitted in a sealed envelopes, super-scribed "Request for Empanelment as OSV for providing Marketing & Back Office Support Services" and reach The GM, IDBI Bank Ltd, IDBI Tower, WTC Complex, Cuffe Parade, Mumbai - 400005 by 3.00 PM on September 14, 2021

Date: 25.08.2021 **Authorised Officer** Place: Mumbai



Ahimsa Industries Limited

CIN: L25200GJ1996PLC028679 Reg. Office: 160, Devraj Industrial Park, Piplaj-Pirana Road, Village Piplaj Ahmedabad GJ 382045

Email: ahimsagreenpet@ymail.com • Website: www.ahimsaind.com ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION

Notice is hereby given that the 26th Annual General Meeting (AGM) of the Shareholders of the Company will be held on Friday, 24th September, 2021 at 11.30 AM IST through Video Conferencing ("VC") or Other Audio Visual Means ("OAVM") to transact the business as set out in the Notice of the 26th AGM in compliance with the applicable provisions of the Companies Act, 2013 ('Act') & Rules framed thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ('Listing Regulations') read with General Circular Nos. 14/2020, 17/2020 and 20/2020 dated April 08, 2020, April 13, 2020 and May 05, 2020 and Circular No. 02/2021 dated January 13, 2021 respectively, issued by the Ministry of Corporate Affairs ('MCA Circulars') and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 and Circular dated January 15, 2021 issued by the Securities and Exchange Board of India ('SEBI Circular') to transact the business as mentioned in the 26th AGM Notice, without the physical presence of the Members at a common venue.

Pursuant to Section 101 of the Act and Regulation 36 of the Listing Regulations and in compliance with the MCA Circulars and SEBI Circular, the Notice of 26th AGM along with the Annual Report 2020-21 will be send to all the Shareholders whose email addresses are registered with the Company / Registrar and Share Transfer Agent / Depositories. The requirements of sending physical copy of the Notice of the 26th AGM and Annual Report to the Members have been dispensed with vide MCA Circulars and SEBI Circular. Members are hereby informed that the said Annual Report including AGM Notice is also available on the Company's website www.ahimsaind.com, website of the Stock Exchange i.e. NSE Limited at www.nseindia.com and on the website of National Securities Depositories Limited (NSDL) at www.evoting.nsdl.com.

Pursuant to Section 108 of the Act and Regulation 44 of the Listing Regulations, the Company is providing its members the e-voting facility to cast their votes on all the resolutions set out in the AGM Notice by using an electronic voting system from a place other than the venue of the AGM (i.e. remote e-voting). The Company will also provide a facility of e-voting to members during the AGM, who have not cast their vote by remote e-voting. The Company has entered into an arrangement with NSDL for providing the remote e-voting and e-voting during the AGM. A person whose name appears on the Register of Members / Beneficial Owners as on the cut-off date i.e. Friday, 17th September, 2021 shall only be entitled to avail the remote e-voting facility or e-voting during the AGM.

The remote e-voting period will commence on Tuesday, 21st September, 2021 (09.00 AM IST) and will end on Thursday, 23[™] September, 2021 (5.00 p.m. IST). During this period, the member(s) of the Company may cast their votes electronically on items mentioned in the AGM Notice. Once the vote on a resolution is cast by a member, any subsequent change shall not be allowed. The voting rights of the members shall be in proportion to their shares in paid-up share capital of the Company as on the cut-off date i.e. Friday, 17th September, 2021. The detailed instructions relating to remote e-voting and e-voting during the AGM are provided in the Notes forming part of the

Only those Members, who will be present in the AGM through VC / OAVM and have not cast their vote on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system available during the 26th AGM. Members who have cast their vote through remote e-voting will be eligible to attend the AGM. However, they will not be eligible to vote at the AGM. The details procedure for voting at e-AGM mentioned in the Notes to Notice of the meeting. Share Transfer books shall remain closed from Friday, September 17, 2021 to Friday, September 24, 2021, both days inclusive.

In case of any queries or issues regarding attending AGM/e-voting, members may refer to the Frequently Asked Questions (FAQs) and e-voting manual available at www.evoting.nsdl.com or contact Ms Sarita Mote, NSDL, 4th Floor, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai - 400013 at e-mail: evoting@nsdl.co.in, Tel. No.: 022-24994738.

Place : Ahmedabad Date : August 24th, 2021 For Ahimsa Industries Limited Sd/- Ashutosh Gandhi Managing Director

સદ્ભાવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ લીમીટેડ

Sadbhav

[CIN: L45202GJ2007PLC049808] **રજીસ્ટર્ડ ઓફીસ:** સદભાવ હાઉસ, લો ગાર્ડન પોલીસ ચોકી સામે, એલિસબ્રીજે, અમદાવાદ-૩૮૦૦૦૬, ગુજરાત **ફोन** : ०७८-२६४६३३८४, ई.इस : ०७८-२६४००२१०,

ยพัช**ต**: investor@sadbhavinfra.co.in, **dัดะแยะ**: www.sadbhavinfra.co.in

કંપનીની ૦૧/૨૦૨૧–૨૨ ખાસ સામાન્ય સભાની નોટીસ અને રીમોટ ઇ-વોટીંગ માહિતી

આથી નોટીસ આપવામાં આવે છે કે સદ્દભાવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ લીમીટેડ(કંપની) ના સભ્યોની ૦૧/૨૦૨૧-૨૨ ખાસ સામાન્ય સભા 'ઇજીએમ'')બુઘવાર, ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ સવારે ૧૧ઃ ૩૦ કલાકે વિડીયો કોન્ફરન્સ (''વીસી '')/ અન્ય ઓડિયો વિઝ્યુઅલ તાધ્યમો (''ઓએવીએમ'') મારફત ઇજીએમની નોટીસમાં જણાવેલ કાર્યો પાર પાડવા માટે યોજાશે.

કોવીડ–૧૯ ની મહામારીને ધ્યાનમાં રાખીને, ભારત સરકાર, કોર્પોરેટ અફેર્સ મંત્રાલય દ્વારા જારી કરાયેલ તેના પરિપત્ર નં. ૧૪/૨૦૨૦ તારીખ ૮ એપ્રિલ, ૨૦૨૦ અને પરિપત્ર નં. ૧૭/૨૦૨૦ તારીખ ૧૩ એપ્રિલ, ૨૦૨૦ અને પરિપત્ર નં. ૨૦/૨૦૨૦ તારીખ ૦૫ મે. ૨૦૨૦, જનરલ પરિષત્ર નં. ૩૯/૨૦૨૦ તારીખ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦, પરિષત્ર નં. ૧૦/૨૦૨૧, તારીખ ૨૩ જુન, ૨૦૨૧ અને સિક્યોરીટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એ તેના પરિપત્ર નં. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 તારીખ ૧૨ મે, ૨૦૨૦ અને પરિપત્ર નં. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 તારીખ ૧૫ જાન્યુઆરી, ૨૦૨૧ (સંયુક્ત રીતે ''પરિપત્રો ' ત્તરીકે દર્શાવેલ છે) અંતર્ગત એક જ સ્થળે સભ્યોની પ્રત્યક્ષ હાજરી વગર વીસી / ઓએવીએમ દ્વારા એજીએમ/ઇજીએમ યોજવાની પરવાનગી આપી છે. ઉપર જણાવેલ પરિપત્રો અને કંપની કાયદા ૨૦૧૩ ની સંબંધિત જોગવાઇઓના અનુપાલન હેઠળ કંપનીના સભ્યોની ઇજીએમ વીસી / ઓએવીએમ દ્વારા યોજવામાં આવી રહી છે.

ક્ષદરહું પરિપત્રો અંતર્ગત મંગળવાર, ૨૪ ઓગસ્ટ, ૨૦૨૧ ના રોજ ઇજીએમ બોલાવતી નોટીસ કંપની અથવા ડિપોઝીટરીઓ પાસે જે મભ્યોના ઇમેઇલ એડ્રેસ રજીસ્ટર્ડ છે તેમને ફક્ત ઇલેક્ટ્રોનિક રીતે મોકલેલ છે. ઇજીએમની નોટીસ કંપનીની વેબસાઇટ <u>www.sadbhavinfra.co.in</u> પર અને સ્ટોક એક્સચેન્જોની વેબસાઇટ એટલે કે બીએસઇ લીમીટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જની બસાઇટ અનુક્રમે <u>www.bseindia.com</u> અને <u>www.nseindia.com</u> ઉપર અને લિંક ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટે. એલઆઇઆઇપીએલ) ની વેબસાઇટ એટલે કે <u>https://instavote.linkintime.co.in</u> પર પણ ઉપલબ્ધ રહેશે.

તાયદાની કલમ ૧૦૮ અને કંપનીઓ (વ્યવસ્થાપન અને પ્રશાસન) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૨૦, સુધારા મુજબ અને સિક્યોરીટીઝ અને બેક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને ડિસક્લોઝર રીક્વાયરમેન્ટ્સ) નિયમનો, ૨૦૧૫ ના નિયમન ૪૪ અંતર્ગત મળ્યોને ઇજીએમની નોટીસમાં જણાવેલ તમામ ઠરાવો પર એલઆઇઆઇપીએલ દ્વારા પુરી પડાયેલ ઇ-વોટીંગ સેવાઓ મારફત ઇલેક્ટ્રોનિકલી ોમના મત આપાની સવલત પુરી પાડેલ છે. સભ્યોના મતદાનના હકો ૦૮ સપ્ટેમ્બર, ૨૦૨૧ (કટ–ઓફ તારીખ)ના રોજ કંપનીની ભરપાઇ યયેલ શેર મુડીમાં તેમની પાસે રહેલ ઇક્વીટી શેરોના હિસ્સાને અનુરૂપ રહેશે.

રીમોટ ઇ-વોર્ટીગનો સમયગાળો રવિવાર, ૧૨ સપ્ટેમ્બર ,૨૦૨૧ ના રોજ સવારે ૯:૦૦ વાગ્યાથી શરૂ થશે અને મંગળવાર, ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ સાંજે પઃ૦૦ વાગ્યે પુર્ણ થશે. આ ગાળા દરમિયાન સભ્યો ઇલક્ટ્રોનિકલી તેમના મતો આપી શકે છે. ત્યાર બાદ રીમોટ ઇ-વોટીંગ મોડ્યુલ એલઆઇઆઇપીએલ દ્વારા બંધ કરવામાં આવશે. વીસી/ઓએવીએમ સવલત મારફત ઇજીએમમાં હાજર રહેનાર સભ્યો અને જેમણે રીમોટ ઇ-વોટીંગ મારફત ઠરાવો પર તેમના મત આપ્યા નથી અથવા તેમ કરવા પ્રતિબંધિત નથી તેઓ ઇજીએમ દરમિયાન ઇ-વોટીંગ પદ્ધતિથી તેમના મત આપવા માટે હકદાર ગણાશે.

જે સભ્યોએ ઇજીએમ પહેલા રીમોટ ઇ−વોટીંગથી તેમના મત આપ્યા છે તેઓ વીસી/ઓએવીએમ મારફત ઇજીએમમાં હાજ૨ પણ રહી શકે છે/ ભાગ લઇ શકે છે, પરંતુ ફરીથી તેમના મત આપવા હકદાર ગણાશે નહી.

ડીમટીરીયલાઇઝ્ડ અને ફ્રીઝીકલ સ્વરૂપે શેરો ધરાવતા સભ્યો અને જે સભ્યોએ ઇજીએમની નોટીસમાં તેમના ઇમેઇલ એડ્રેસો રજીસ્ટર્ડ કરાવ્ય નથી તેવા સભ્યો દ્વારા રીમોટ ઇ-વોટીંગ અને ઇજીએમ ખાતે મતદાનની રીત ઇજીએમની નોટીસમાં આપેલ છે.

કંપની દ્વારા ઇલેક્ટ્રોનિક રીતે નોટીસ મોકલ્યા પછી કંપનીના શેરો પ્રાપ્ત કરનાર અને કંપનીની સભ્ય બનનાર અને કટ–ઓફ તારીખના રોજ શેરો ધરાવતી કોઇપણ વ્યક્તિ ઇજીએમ બોલાવતી નોટીસમાં આપેલ પ્રક્રિયા અનુસરીને લોગીન આઇડી અને પાસવર્ડ મેળવી શકે છે. આમ છતાં, જો તે/તેણી પહેલેથી સીડીએસએલ/એનએસડીએલ/ડિપોઝીટરી પાર્ટીશીપન્ટમાં રીમોટ ઇ-વોટીંગ માટે રજીસ્ટર્ડ છે તો તેઓ તેના/તેણીના વર્તમાન યુઝર આઇડી અને પાસવર્ડનો મત આપવા માટે ઉપયોગ કરી શકે છે.

ડ–વોટીંગને લગતી કોઇપણ પુછપરછ માટે સભ્યો હેલ્પસેક્શન હેઠળ <u>https://instavote.linkintime.co.in</u>ઉપર ઉપલબ્ધ ફ્રીકવન્ટલી આસ્ક્ડ ક્વેશ્વન્સ (એફએક્યુએસ) અને ઇ-વોટીંગ મેન્યુઅલ જોઇ શકે છે અથવા <u>enotices@linkintime.co.in</u> ને ઇમેઇલ લખી શકે છે અથવા અમને કોલ કરી શકે છેઃ ટેલિઃ ૦૨૨-૪૯૧૮૬૦૦૦

સદ્ભાવ ઇન્ફાસ્ટ્રક્ચર **પ્રોજેક્ટ લીમીટેડ** વતી

સહી/-

હાર્દિક મોદી

કંપની સેક્રેટરી

સ્થળ: અમદાવાદ **તારીખ:** ૨૫ ઓગસ્ટ, ૨૦૨૧ TATA ELXSI LIMITED

CIN: L85110KA1989PLC009968 Regd Off: ITPB Road, Whitefield, Bengaluru - 560048 Tel: 080-2297-9123 Email: investors@tataelksi.com website: www.tataelksi.com

NOTICE

Notice is hereby given pursuant to circular no. SEBI/HO/MIRSD/DOS3/CIR/P/2018/139 dated November 6, 2018 issued by the Securities and Exchange Board of India, that the Company has received the following requests to transfer the equity shares from the name(s) of the shareholder(s) ("Transferor") to the name(s) of the proposed transferee(s) ("Transferee") The details of the proposed transfers are as follows:

SN	Folio No.	No. of equity shares of ₹10 each	Name of the Transferor(s)	Distinctive numbers	Name of the Transferee(s)
1	EXV0002339	100	Vijay Kumar Kapoor Surinder Kumar Sabharwal	15422411 – 15422510	DEEPAK JUNEJA
2	EXS0013698	100	Surinder Kumar Sabharwal Vijay Kumar Kapoor	10600811 - 10600910	DEEPAK JUNEJA

Any person who has any objection in respect of the proposed transfer of equity shares referred to above, shall intimate in writing to the Company Secretary at the Registered Office of Company and/or to the Registrar & Transfer Agent, TSR Darashaw Consultants Private Limited, within 30 days from the date of publication of this notice and if no objection is received by the Company within the stipulated period then the Company shall proceed with the transfer of the said equity shares in favour of the above-mentioned transferee(s), without any further intimation. The information is also being made available on the website of the Company at www.tataelxsi.com For TATA ELXSI LIMITED

Place : Bengaluru G Vaidyanathan Date : August 24, 2021 General Counsel & Company Secretary

क्रेनरा बैंक Canara Bank ≰A

રીજીયોનલ ઓફીસ - વડોદરા કેનેરા બેંક (સિન્ડિકેટ બેંક પૂર્વે), એક્સપ્રેસસ હોટલ સામે આર.સી.દત્ત રોડ, અલકાપુરી, વડોદરા–૩૯૦૦૦७. ફોનઃ૦૨૬૫–૨૩૫૮૧૧૫/૨૩૧૦૫૫૫

કબજા નોટીસ

આથી નીચે સહી કરનાર **કેનેરા બેંક (સિન્ડિકેટ બેંક પૂર્વે),** ના અધિકૃત અધિકારીએસિક્ચોરિટાઇઝેશન અને રીકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સીયલ એસેટસ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ हેઠળ અને સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) ૩લ્સ ૨૦૦૨ ના ૩લ્સ ૩ સાથે વાંચતા સેક્શન ૧૩(૧૨) હેઠળ પ્રાપ્ત થયેલ સત્તાની રૂએ ડિમાન્ડ નોટિસ જે તે મિલકતના કરજદારને આપવામાં આવે છે કે નોટીસમાં દર્શાવેલ રકમ વ્યાજ સાથે ઉપરોક્ત નોટીસ મળ્યાની તારીખ થી ૬૦ દિવસની અંદર પરત ચુકવણી કરી દેવા માટે ઇશ્યુ કરવામાં આવી છે.

કરજદારો/જામીનદારો/માલિક ઉપરોક્ત રકમ પરત ચૂકવવામાં નિષ્ફળ ગયા હોવાથી, કરજદાર અને જાહેર જનતાને નોટિસ દ્વારા જણાવવામાં આવે છે કે નીચે સહી કરનારે સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ ના રૂલ ૮ સાથે વંચાતા કાયદાની કલમ ૧૩ (૪) હેઠળ મને આપવામાં આવેલ સત્તાની રૂએ નીચે જણાવેલ મિલકતનો સાંકેતીક કબજો લીધેલ છે.

મિકલતના માલિક, કરજદાર અને જામીનદાર અને જાહેર જનતાને સામાન્ય રીતે અહીંથી ચેતવણી આપવાની કે નીચે દર્શાવેલ મિલકતો અંગે કોઈ વ્યવહાર કરવો નહીં અને મિલકતો અંગે કોઈપણ વ્યવહાર **કેનેરા બેંક,** ની નીચે દર્શાવેલ શાખા ના બાકી રકમ અને ચડત વ્યાજ તથા ખર્ચા સાથે પૂરેપુરી રકમ ન ચૂકવાય ત્યાં સુધી બોજાને આધીન રહેશે. સિકચોર્ડ મિલકત છોડાવવા ઉપલબ્ધ સમય બાબતે ઉક્ત એક્ટના સેકશન ૧૩ ના સબ–સેકશન (૮)ની જોગવાઇ

સિકચોર્ડ મિલકત છોડાવવા ઉપલબ્ધ સમય બાબતે ઉક્ત એક્ટના સેકશન ૧૩ ના સબ–સેકશન (૮)ની જોગ્ તરફ કરજદારનું ધ્યાન દોરવામાં આવે છે.							
ક્રમ	:	ડિમાંન્ડ નોટીસ ની તારીખ અને રકમ	મિલકત નું વર્ણન	પઝેશન નો પ્રકાર/તારીખ			
٦.	<u>કતેહગંજ શાખા</u> આઇ એસ સ્ટીલ, માલિકઃ ઓનાલી હાજીસ્માઇલ બાલડીવાલા	તા. ૨૮.૦૪.૨૦૨૧ રૂા.૧૫,૪૧,૪૪૩.७૫ (રૂા. પંદર લાખ એક્તાલીસ હજાર ચારસો તેત્તાલીસ અને પંચોતેર પૈસા પુરા) + તેના ઉપરનું વ્યાજ	મિલકત ની જમીનનો તમામ ભાગ અને હિસ્સો જે આવેલ છે તે બિન ખેતી લાચક પ્લોટ ની જમીન મોજે બાપોદ, વડોદરા ખાતે આવેલ જમીન નો આરએસ નં. ૨૩૩, ''શ્રી સરદાર સહકારી ઉદ્યોગનગર સોસાચટી'' શેડ નં. ઇ–૬૫ નું ક્ષેત્રફળ ૫૦૧.૮૫ ચોરસ મીટર છે. માલિકઃ શ્રી ઓનાલી હાજીસ્માઇલ બાલડીવાલા છે. ચતુઃસીમાઃ પૂર્વઃ શેડ નં. ઇ/૫૨, ઉત્તરઃ શેડ નં. ઇ/૬૬, પશ્ચિમઃ શેડ નં. ૩, દક્ષિણઃ શેડ નં. ઇ/૬૪.	૧૯.૦૮.૨૦૨૧ સાંકેતીક			
₹.	<u>દાહોદ શાખા</u> મેસર્સ વિનોદ સેલ્સ (કરજદાર) માલિકઃ વિનોદચંદ્ર રામસીંગ ગડરીચા અને જામીનદારઃ શ્રી જીતેષ બાલકિષ્ણ ગલીચાવાલા	તા. ૦७.૦૫.૨૦૨૧ રૂા.૮,७૩,૩૬૫.७૦ (રૂા. આંઠ લાખ તોત્તેર હજાર ત્રણસો પાંસઠ અને સીત્તેર પૈસા પુરા) + તેના ઉપરનું વ્યાજ	આર.એસ. નં. ૩૬૮ અને ૩૬૯, પૈકી સીએસ નં. ૮૧७૨ પૈકી પ્લોટ પટિક પૈકી, પ્લોટ નં. પૈકી પ્લોટ નં. ડી (૪૧.૧૪૮ ચોરસ મીટર) જમીન સાથે બાંધાચેલ ઘર નં. ૮૧૭૨/૧૮ જે સહકાર નગર, ગરબડા રોક, દાહોદ, ગુજરાત. પીનઃ ૩૮૯૧૫૧.	૨૧.૦૮.૨૦૨૧ સાંકેતીક			
3.	<u>દાહોદ શાખા</u> શ્રી વિક્રમ શંકરલાલ શર્મા (કરજદાર) અને જામીનદારઃ શ્રી અર્પિત રજનીકાન્ત જાની	તા. ૨૬.૦૪.૨૦૨૧ રૂા. ७,७०,૩૧૮.૯૮ (રૂા. સાત લાખ સીત્તેર હજાર ત્રણસો અઠાર અને અઠાણું પૈસા પુરા) + તેના ઉપરનું વ્યાજ	ફલેટ જી–૧, ગ્રાઉન્ડ ફલોર, જાનકી એપાર્ટમેન્ટ, બૈકુઠ દામ–૨ ની અંદર, રાજ ટાવર પાસે, માંડવા રોડ, દાહોદ, ગુજરાત–૩૮૯૧૫૧.	૨૧.૦૮.૨૦૨૧ સાંકેતીક			
۲.	<u>ગોરવા શાખા</u> શ્રી દિપક રાજકિશોર ભારતી અને શ્રીમતી નિકિતા દિપક ભારતી (કરજદાર)	તા. ૧૦.૦૪.૨૦૨૧ અને રૂા. ૫૮,૦૦,૯૧७ (રૂા. અઠાવન લાખ, નવસો સત્તર ફકત) + તેના ઉપરનું વ્યાજ	રહેણાંક બંગ્લોઝ નં. ૩૯ જે ''મહેશ્વરી કો.ઓપ. હાઉસીંગ સોસાયટી'' આર.એસ. નં. ૮७, મોર્ડન પબ્લીક સ્કુલ પાસે, કડીડીચા મહેશ્વરી રોડ, બાજવા ખાતે આવેલ છે. જે શ્રી દિપક રાજકિશોર ભારતી અને શ્રીમતી નિકિતા દિપક ભારતીના નામે છે.	૧૯.૦૮.૨૦૨૧ પ્રત્યેક્ષ			
ч.	ભરૂચ શાખા શ્રી નવીનકુમાર છગનલાલ સોની અને સોનલબેન નવીનભાઇ સોની	તા. ૧૩.૦૪.૨૦૨૧ અને રૂા. ૧૩,૫૩,૨૬૯.७૨ (રૂા. તેર લાખ, ત્રેપ્પન હજાર બસો અગ્ણસીતેર અને બોતેર પૈસા ફકત) + તેના ઉપરનું વ્યાજ	ફલેટ નં./પ્લોટ નં. ૨૨૦, વાસુદેવ કો–ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી, આર.એસ. નં. 30/એ પૈકી ભોલે, ભરૂચ, ગુજરાત ખાતે આવેલ છે. તે શ્રી નવિનકુમાર છગનલાલ સોની અને સોનલબેન નયનભાઇ સોની ના નામે છે.	૧૯.૦૮.૨૦૨૧ સાંકેતીક			
5.	<u>ગોધરા શાખા</u> શ્રી અશોક એચ. ભોસલે શ્રીમતી આશા એ. ભોસલે અને શ્રી પ્રશાંત એ. ભોસલે (કરજદાર)	તા. ૨૮.૦૪.૨૦૨૧ અને રૂા. ૮,૩૯,૩૯૯.૮૩ (રૂા. આંઠ લાખ, ઓગણચાતીસ ત્રણસો નવાણું અને ત્યાસીં પૈસા ફક્ત) + તેના ઉપરનું વ્યાજ	સ્થાવર મિલકતનો તમામ ભાગ અને હિસ્સો આર.એસ. નં. ૧૫૫/૧ પૈકી ૯, ખાતા નં. ૮૬૦ પૈકી પ્રાઇવેટ પ્લોટ નં. ૧૯ નું ક્ષેત્રફળ ૧७૩–૧૪ ચોરસ મિટર જમીન બાંધકામ ગ્રામ પંચાયત ઘર નં. ૬૨૬ જે ઝાફરાબાદ ચોગેશ્વર સોસાયટી, આઇટીઆઇ કોલેજની પાછળ, ગોધરા, પંચમહાલ ખાતે આવેલ છે. શ્રી અશોક એચ. ભોસલે, શ્રીમતી આશા એ. ભોસલે અને શ્રી પ્રશાંત એ. ભોસલે ના નામે છે. ચતૃઃસીમાઃ પૂર્વઃ જમીન નો પ્લોટ નં. ૨૬, પશ્ચિમઃ ૬.૦૦ મીટર રોડ, ઉત્તરઃ જમીન નો પ્લોટ નં. ૨૦, દક્ષિણઃ જમીન નો સેર્વ નં. ૧૫૫/૨.	૨૪.૦૮.૨૦૨૧ સાંકેતીક			
v.	તા. ૨૮.૦૪.૨૦૨૧ અને ગ્રા. ७,૦૮,७૫૪.૦૬ (ગ્રા. સાત લાખ, આંઠ હજાર સાતસો ગ્રોપન અને પૈસા જામીનદાર) ને તેના ઉપરનું વ્યાજ		સ્થાવર મિલકતનો તમામ ભાગ અને હિસ્સો આર.એસ. નં. ૧૪૦/૧૧+૧/૨ પૈકી (એકાઉન્ટ નં. ૮૨૦૦), પહેલો માળ, પાલ કી મુની ઘર નં. ૧/૧, ૧૯/એસએન/પ૯/૨, ઘનશ્યામ હોસ્પીટલ ની સામે, ભુરાવાવ, ગોધરા, પંચમાહાલ–૩૮૯૦૦૧ ખાતે આવેલ છે. શ્રી દિપક રાજેશ ઇસરાની ના નામે છે.	૨૪.૦૮.૨૦૨૧ સાંકેતીક			
٤.	<u>ગોધરા શાખા</u> શ્રીમતી નિતાબેન જેઠાભાઇ દામોર (કરજદાર), શ્રી અમીત જેઠાભાઇ દામોર (જામીનદાર)	તા. ૨૮.૦૪.૨૦૨૧ અને રૂા. ७,૬૬,૬૬૬.૯૦ (રૂા. સાત લાખ, છાંસષ્ટ હજાર છસો છાંસષ્ટ અને નેવુ પૈસા ફક્ત) + તેના ઉપરનું વ્યાજ	સ્થાવર મિલકતનો તમામ ભાગ અને ફિસ્સો મિલકતનો પ્લોટ નં. ૪७, સર્જન કુપ્લેક્ષ, ગોવિંદ, ગોઘરા, પંચમહાલ–૩૮૯૦૦૧ ખાતે આવેલ છે. શ્રીમતી નિતાબેન જેઠાભાઇ દામોર ના નામે છે.	૨૪.૦૮.૨૦૨૧ સાકેતીક			
e.	<u>ગોધરા શાખા</u> શ્રી પ્રકાશકુમાર કુંદનદાસ લોહાણા અને શ્રીમતી અંજનાબેન કુંદનદાસ લોહાણા (કરજદાર)	તા. ૨૮.૦૪.૨૦૨૧ અને રૂા. ૧૦,૩૬,૮૯૩.૫७ (રૂા. દસ લાખ, છત્રીસ હજાર આંઠસો ત્રાણુ અને સત્તાવન પૈસા ફક્ત) + તેના ઉપરનું વ્યાજ	સ્થાવર મિલકતનો તમામ ભાગ અને હિસ્સો નો આર.એસ. નં. ૧૨૮ પૈકી ૪૬, (એન.એ. જમીન) પ્રાઇવેટ પ્લોટ નં. ૭, પૈકી પૂર્વ બાજુનું ક્ષેત્રફળ ૬૭–૪૯ ચોરસ મીટર, ગોધરા નગર ઘર નં. ૧/૧૯૪/પીડી/૭ ખાતે બંધાચેલ જે ગોધરા, પદમાવતી સોસાથટી, તા. ગોધરા, પંચમહાલ ખાતે આવેલ છે. શ્રી પ્રકાશકુમાર કુંદનદાસ લોહાણા અને શ્રીમતી અંજનાબેન કુંદનદાસ લોહાણા ના નામે છે.	૨૪.૦૮.૨૦૨૧ સાંકેતીક			
۹٥.	<u>ગોધરા શાખા</u> શ્રી સાગરકુમાર પ્રમોદકુમાર જોષી (કરજદાર) અને શ્રી વિશાલ જીતેન્દ્ર પટેલ (જામીનદાર)	તા. ૨૮.૦૪.૨૦૨૧ અને રૂા. ૧૨,૮૫,૬७૧.૦७ (રૂા. બાર લાખ, પંચ્ચાશી હજાર છસો ઇકોતેર અને સાત પૈસા ફક્ત) + તેના ઉપરનું વ્યાજ	સ્થાવર મિલકતનો તમામ ભાગ અને હિસ્સો નો સી– ૧૦૬, લેક વ્યુ રેસીકન્સી, સ્પોંટ કોમ્પ્લેક્ષ પાસે, કાનેલાવ, જાફરાબાદ, ગોધરા, પંચમદાલ–૩૮૯૦૦૧ ખાતે આવેલ છે. જે શ્રી સાગરકુમાર પ્રમોદકુમાર જોષી ના નામે છે.	૨૪.૦૮.૨૦૨૧ સાંકેતીક			
11.	<u>ગોધરા શાખા</u> શ્રી વિજ્યકુમાર રમણલાલ સોલંકી શ્રી રમણભાઈ એસ. સોલંકી નો છોકરો	તા. ૦૮.૦૪.૨૦૨૧ અને રૂા. ૪,૫૮,૪૨૨.૩૬ (રૂા. ચાર લાખ, અદ્વાવન હજાર ચારસો બાવીસ અને છત્રીસ પૈસા ફક્ત) + તેના ઉપરનું વ્યાજ	સ્થાવર મિલકતનો તમામ ભાગ અને હિસ્સો નો પ્લોટ નં. ૨૪, આ.એસ. નં. ૪૧, અંબીકા નગર, એસ.આર.પી. ડાકોર રોડ, ગોધરા – ૩૮૯૦૦૧ ખાતે આવેલ છે. જે શ્રી વિજયકુમાર રમણલાલ સોલંકી ના નામે છે.	૨૪.૦૮.૨૦૨૧ સાંકેતીક			
۹٦.	<u>ગોધરા શાખા</u> શ્રી વિજયકુમાર રમણલાલ સોલંકી શ્રી રમણભાઇ એસ. સોલંકી નો છોકરો	તા. 0૮.0૪.૨૦૨૧ અને રૂા. ૩,૮૨,૧૦૯.૪૦ (રૂા. ત્રણ લાખ, વ્યાંસી હજાર એકસો નવ અને યાલીસપૈસા ફક્ત) + તેના ઉપરનં વ્યાજ	સ્થાવર મિલકતનો તમામ ભાગ અને ફિસ્સો નો પ્લોટ નં. ૨૪, આ.એસ. નં. ૪૧, અંબીકા નગર, એસ.આર.પી. ડાકોર રોડ, ગોધરા – ૩૮૯૦૦૧ ખાતે આવેલ છે. જે શ્રી વિજથકુમાર રમણલાલ સોલંકી ના નામે છે.	૨૪.૦૮.૨૦૨૧ સાકેતીક			

તા.: ૨૫.૦૮.૨૦૨૧ – સ્થળઃ વડોદરા નોંધઃ વિવાદની સ્થિતિમાં આ નોટીસનો અંગ્રેજી અનુવાદ માન્ય ગણાશે. અધિકૃત અધિકારી – કેનેરા બેંક

+ તેના ઉપરનું વ્યાજ

THEMIS MEDICARE LIMITED CIN: L24110GJ1969PLC001590

Regd. Office. Plot no. 69-A, GIDC Industrial Estate, Vapi-396 195, Dist. Valsad, Gujarat Phone No: 91-22-67607080 Fax: 91-22-67607019 Website http://www.themismedicare.com. | E-mail: themis@themismedicare.com

1. NOTICE is hereby given that the 51st Annual General Meeting (AGM) of Themis Medicare Limited (the Company) will be held through Video Conferencing("VC")/Other Audio-Visual Means("OAVM") on Friday, 18th September, 2021 at 12 Noon, in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and rules made thereunder and the Securities and Exchange Board of India(Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, read with General Circulars No. 14/2020 dated April 08, 2020; No. 17/2020 dated April 13, 2020 and No.20/2020 dated May 5, 2020, No. 02/2021 dated January 13, 2021 and other applicable circulars issued by the Ministry of Corporate Affairs("MCA") and circular No. SEBI/HO/CFD/ CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 and Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021 of SEBI (collectively referred to as "applicable circulars"), to transact the business set out in the Notice convening the AGM. Members will be able to attend and vote at the AGM through VC/OAVM. Members participating through the VC/OAVM facility only shall be deemed to be present at the AGM and their presence shall be reckoned for the purpose of quorum.

2. In compliance with the applicable circulars, the Notice convening the AGM and the standalone and consolidated financial statements for the financial year 2020-21, along with Board's Report, Auditors' Report and other documents required to be attached thereto, will be sent to all the Members of the Company whose email addresses are registered with Company/ Depository Participants(s). Considering the COVID-19 pandemic, the Company shall not be able to provide service of documents to the shareholders, except through email. Hence, the Company requests all the shareholders who have not yet registered their email addresses or have not updated their email addresses with the Company/RTA to register the same. The aforesaid documents will also be available on the Company's website at www.themismedicare.com and on the website of the Stock Exchanges i.e. BSE Limited and NSE Limited at www.bseindia.com and www.nseindia.com respectively,and also on the website of Central Depository Services (India) Limited (CDSL) at www.evotingindia.com.

3. Manner of registering/updating email address by members: a. In case of Shares held in Physical Mode:

The Shareholder may send a request quoting its Folio No. to RTA

by email at rnt.helpdesk@linkintime.co.in b. In the case of Shares held in Demat mode: The shareholder may please contact the Depository Participant

("DP") and register the email address and bank account details in the demat account as per the process followed and advised by the 4. Manner of casting vote(s)

a) Members will have an opportunity to cast their vote(s) on the ness as set out in the voting system('e-voting')

b) The Manner of voting remotely ("remote e-voting") by members holding shares in dematerialized mode, physical mode and for members who have not registered their email address has been provided in the Notice of AGM. c) The facility for voting through electronic voting system will also

be made available at the AGM and Members attending the AGM through VC/OAVM who have not cast their vote(s) by remote evoting will be able to vote at the AGM. d) The login credentials for casting votes through e-voting shall be made available to the members through email. Members who do

not receive email or whose email address are not registered with Company/RTA/Depository Participant(s), may generate login credentials by following instructions given in the 'Notes' forming part of Notice of AGM. e) The login credentials and manner for attending the AGM

through VC/OAVM can be obtained by following instructions given in the 'Notes' forming part of Notice of AGM. 5. Dividend

a) The Board has recommended a dividend of Rs. 4.30/- per share at its meeting held on 27th May, 2021. The Register of Members and Share Transfer Books will remained closed from Saturday, 11th September 2021 to Saturday,18th September 2021 (both days inclusive) for the purpose of AGM and determining the names of the Members eligible for payment of dividend for the financial year 2020-21, if declared at the AGM.

b) Subject to approval of members at the AGM, the dividend will be paid to the Members whose name appear on the Company's Register of Members as on Saturday 10th September, 2021, and in respect of shares held in demat mode, to the Members whose names are furnished by National Securities Depository Limited ("NSDL") and the Central Depository Services (India) Limited ("CDSL"), collectively "Depositories" as beneficial owners as on that date.

c) As per the applicable circulars payment of dividend shall be made through electronic mode to the members who have updated their bank account details. Dividend warrants / demand drafts will be dispatched to the registered address of the shareholders who have not updated their bank account details, after normalization of the postal services.

d) Payment of dividend will be subject to deduction of Tax at source (TDS) at applicable rate. For more details please refer to the 'Notes' forming part of Notice of AGM.

6. Manner of registering mandate for receiving Dividend. Members are requested to register/update their complete bank

a) With their depository participant(s) with whom they maintain their demat accounts, if shares are held in dematerialized mode by submitting the requisite documents and b) With the Company/Link Intime Private Limited by emailing at

cfoassist@themismedicare.com or rnt.helpdesk@linkintime.co.in, if shares are held in physical mode, by submitting (i) scanned copy of the signed request letter which shall contain member's name, folio number, bank details(Bank account number, Bank Branch name and address IFSC, MICR details), (ii) self attested copy of the Pan card and (iii) cancelled cheque leaf.

7. Members are requested to read and understand all the 'Notes' forming part of the Notice convening AGM Particularly those dealing with manner of casting vote through remote e-voting or during AGM

By order of Board For Themis Medicare Limited Place: Mumbai Sangameshwar lyer Date: 23/08/2021 (Company Secretary& Compliance officer)